

23<sup>rd</sup> January, 2025

To,

The Manager (Listing), The BSE Ltd. Mumbai	The Manager (Listing), National Stock Exchange of India Ltd. Mumbai
Company's Scrip Code: 505700	Company's Scrip Code: ELECON

**Sub. : Intimation under Regulation 47 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015**

Dear Sir/Madam,

With reference to the subject referred Regulation, we would like to inform you that the Extract of Unaudited Financial Results for the quarter and nine months ended on 31<sup>st</sup> December, 2024 has been published in The Business Standard Newspaper in English and Jay Hind Newspaper in Gujarati on 23<sup>rd</sup> January, 2025.

The copies of the said newspaper advertisements are enclosed for your reference and record.

Thanking you,

Yours faithfully,

For Elecon Engineering Company Limited,



**Bharti Isarani**  
Company Secretary & Compliance Officer

Encl.: As above



Cranes



Rubber Industry



Marine Industry



Plastic Industry



Power Industry



Steel Industry



Sugar Industry



Mining



Cement Industry

**Gearing industries. Gearing economies.**

**SAMMAAN CAPITAL LIMITED**  
 Regd. Office: 5<sup>th</sup> Floor, Building No. 27, KG Marg, Connaught Place, New Delhi - 110001  
**NOTICE FOR SALE OF STRESSED FINANCIAL ASSETS**  
 Sammaan Capital Limited, a non-banking financial company, invites Expression of Interest (EOI) along with non-disclosure agreement for sale of Stressed Financial Assets. Interested eligible investors are requested to intimate their willingness to participate in the auction by way of an "Expression of Interest".  
 The data room will be open from Jan 30, 2025 to Feb 20, 2025, and last day for submission of bid is Feb 28, 2025.  
 For detailed terms and conditions, please mail us at: loansanagement\_sds@sammaancapital.com  
 Mumbai, Jan 23, 2025

**Technocrat Industries (India) Limited**  
 Regd. Office: Technocrat House, A-25, Road No. 3, MIDC Industrial Estate, Andheri (E), Mumbai - 400093  
 Tel: 4098 2222; Fax No. 4098 2200; CIN: L28120MH1992PLC09252  
 Email: investor@technocratgroup.com  
 website: www.technocratgroup.com  
**NOTICE**  
 Pursuant to Regulation 29 (1) (a) of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, notice is hereby given that a Meeting of the Board of Directors of the Company will be held on Tuesday, February 11, 2025, inter-alia to consider and approve the Un-Audited Standalone & Consolidated Financial Results for the quarter ended December 31, 2024.  
 This information is also available on the website of the Company at www.technocratgroup.com and on the websites of the Stock Exchanges where the shares of the Company listed at www.bseindia.com and www.nseindia.com.  
**For Technocrat Industries (India) Limited**  
 Sd/-  
 Neeraj Rai  
 Company Secretary  
 Place: Mumbai  
 Date: January 22, 2025

**ZEEMEDIA**  
**ZEE MEDIA CORPORATION LIMITED**  
 Registered Office: 135, Continental Building, 2nd Floor, Dr. Annie Besant Road, Worli, Mumbai - 400018, Maharashtra  
 Corporate Office: F-9, Sector 16A, Noida - 201301, U.P.  
 E-mail: complianceofficer@zeemedia.com  
 CIN: L92100MH1999PLC1215606  
 Website: www.zeemedia.in, Tel: 0120-2511064-73  
**POSTAL BALLOT NOTICE**  
**NOTICE** is hereby given pursuant to Section 110 read with Section 108 and other applicable provisions, if any, of the Companies Act, 2013, (as amended from time to time), read with Rule 20 and 22 of the Companies (Management and Administration) Rules, 2014, Regulation 44 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, the Secretarial Standard on General Meetings issued by ICSI ("SS-2"), General Circular No. 09/2024 dated September 19, 2024, or any other applicable Circulars issued by the Ministry of Corporate Affairs ("MCA") ("MCA Circulars"), and applicable circulars issued by SEBI and other applicable laws, as amended, that Company is seeking approval of the Members of the Company, on the Special Resolutions set forth in the Postal Ballot Notice, through remote electronic voting only, details of which are set out in Postal Ballot Notice dated January 13, 2025 ("Notice").  
 Pursuant to the MCA Circulars, the Company has sent the Notice along with explanatory statement through electronic mode on January 22, 2025, to those Members whose names appear in the Register of Members/Beneficial Owners and whose e-mail IDs are registered with Company/Company's Registrar and Transfer Agent (RTA)/ Depository Participants (DPs) as on the cutoff date i.e. Friday, January 17, 2025. Accordingly, a physical copy of the Postal Ballot Notice along with Postal Ballot Form and pre-paid business reply envelope are not being sent to the Members. The Notice along with explanatory statement is also available on the website of the Company at www.zeemedia.in, and also on the website of stock exchanges i.e. www.bseindia.com and www.nseindia.com and on the website of National Securities Depository Limited ("NSDL") at www.evoting.nsdl.com.  
 The Company is providing Remote E-Voting facility through E-Voting Platform of NSDL. The Board of Directors have appointed Ms. Mita Sanghani (CP No. 6364), Partner of MP Sanghani & Associates LLP (FRN: L2020MH07000), as the Scrutinizer for conducting the Postal Ballot process, in a fair and transparent manner. The Members are requested to note the E-Voting Instructions as follows:  
 (a) The Remote E-Voting period will commence on **Thursday, January 23, 2025 at 9:00 A.M.** and ends on **Friday, February 21, 2025, till 5:00 P.M.** During this period, shareholders of Company as on cut-off date holding shares, may cast their vote electronically. The Remote e-voting module shall be disabled after the prescribed date and time. Once the vote on resolution is casted, the Shareholder shall not be allowed to change it.  
 (b) Members are requested to carefully read all the Notes set out in the Notice including procedure of casting vote through Remote E-Voting.  
 (c) In case of any query on remote e-voting, Members may refer to FAQs and/or e-voting user manual available on website of NSDL at www.evoting.nsdl.com or call on toll free no. 022-4886 7000 or mail at evoting@nsdl.co.in.  
 The result of the Postal Ballot along with the Scrutinizer's Report will be announced within permissible timelines and the same will be displayed on the website of the Company viz. www.zeemedia.in, besides being communicated to Stock Exchanges where share of the Company are listed and NSDL.  
 By order of the Board  
**For Zee Media Corporation Limited**  
 Ranjit Srivastava  
 Company Secretary & Compliance Officer  
 Membership No. A16577  
 Place: Noida  
 Date: January 23, 2025

**INDBANK MERCHANT BANKING SERVICES LIMITED**  
 (A Subsidiary of Indian Bank)  
 Regd. Office: First Floor, Khiraj Complex 1, No. 480, Anna Salai, Nandanam, Chennai 600 035. Phone: 044 45313000 / 45313077  
 CIN No. L65191TN1989PLC017863 Email: investors@indbankonline.com Website: www.indbankonline.com  
**Statement of Un-Audited Financial Results for the Quarter ended 31.12.2024**

Sl. No.	Particulars	Quarter ending	Year to date figures	Corresponding three months ended in the previous year
		31/12/2024 Un-Audited	31/12/2024 Un-Audited	31/12/2023 Un-Audited
		Rs. lakhs		
1.	Total Income From Operations	565.07	2149.60	660.19
2.	Net Profit / (Loss) for the period (before tax, Exceptional and / or Extraordinary items)	189.37	997.86	327.33
3.	Net Profit / (Loss) for the period before tax (after Exceptional and / or Extraordinary items)	189.37	997.86	327.33
4.	Net Profit / (Loss) for the period after tax (after Exceptional and / or Extraordinary items)	117.39	732.54	255.94
5.	Total Comprehensive Income for the period [Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	114.02	722.42	252.71
6.	Equity Share Capital	4437.82	4437.82	4437.82
7.	Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of the previous year		3899.09	
8.	Earnings Per Share (of Rs.10/- each) (for continuing and discontinued operations) -			
	1. Basic	0.26	1.65	0.58
	2. Diluted	0.26	1.65	0.58

Note: (1) The above financial results have been reviewed by the Audit Committee of Board and approved by the Board of Directors at their meeting held on 21.01.2025. (2) The above is an extract of the detailed format of Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full format of the Financial Results are available on the Company's Website. NSE: www.nseindia.com, BSE: www.bseindia.com and our company's website www.indbankonline.com or scan the below QR Code.

Place: Chennai  
 Date: 21.01.2025

For IndBank Merchant Banking Services Limited  
**V HARIBABU**  
 PRESIDENT AND WHOLE TIME DIRECTOR

**Ind Bank Housing Ltd.**  
 (A Subsidiary of Indian Bank)  
 Registered Office: 3rd Floor, Khiraj Complex 1, No. 480, Anna Salai, Nandanam, Chennai 600 035.  
 CIN No. L65927TN1991PLC020219 Email: indhouse1991@gmail.com Website: www.indbankhousing.com Ph: 044 2432 9235  
**Statement of Unaudited Financial Results for the Quarter ended 31.12.2024**

Sl. No.	Particulars	Three months ended	Year to date figures for the current period ended	Corresponding three months ended in the previous year
		31.12.2024 Unaudited	31.12.2024 Unaudited	31.12.2023 Unaudited
		Rs. lakhs		
1.	Total Income	6,764	19,044	8,222
2.	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary Items)	(5,155)	(25,415)	(8,65)
3.	Net Profit / (Loss) for the period before Tax (after Exceptional and/or Extraordinary Items)	(5,155)	(25,415)	(8,65)
4.	Net Profit / (Loss) for the period after Tax (after Exceptional and/or Extraordinary Items)	(5,155)	(25,415)	(8,65)
5.	Total Comprehensive Income for the period [Comprising Profit/(Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	(5,153)	(25,413)	(8,65)
6.	Equity Share Capital	1000.00	1000.00	1000.00
7.	Reserves (excluding Revaluation Reserves) as shown in the Audited Balance Sheet of previous year	(13056.72)	(13056.72)	(12987.67)
8.	Earnings Per Share (of Rs.10/- each) (for continuing and discontinued operations) -			
	1. Basic	(0.052)	(0.254)	(0.09)
	2. Diluted	(0.052)	(0.254)	(0.09)

Note: The above is an extract of the detailed format of Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full format of the Financial Results are available on the Stock Exchange Websites. BSE: www.bseindia.com and our company website: www.indbankhousing.com

Place: Chennai  
 Date: 21.01.2025

By the Order of the Board  
**V HARIBABU**  
 MANAGING DIRECTOR

**JM FINANCIAL CREDIT SOLUTIONS LIMITED**  
 Corporate Identity Number: U7140MH1980PLC022644  
 Regd. Office: 7<sup>th</sup> Floor, Chenergy, Appasaheb Marathe Marg, Prabhadevi, Mumbai 400 025.  
 Tel. No. +91 22 6530 3030 - Fax No. +91 22 6530 3223  
 Website: www.jmfinancialcreditsolutions.com  
**STATEMENT OF UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED DECEMBER 31, 2024**

Sr. No.	Particulars	Quarter Ended			Year Ended
		31.12.2024 Unaudited	31.12.2023 Unaudited	31.03.2024 Audited	
		₹ (in Crores)			
1.	Total Income from Operations	229.16	330.24	1,304.82	
2.	Profit before Tax for the period / year (before, Exceptional and / or Extraordinary items)	3.70	115.45	66.90	
3.	Profit before Tax for the period / year (after, Exceptional and / or Extraordinary items)	3.70	115.45	66.90	
4.	Net Profit for the period / year	2.71	86.36	47.16	
5.	Total Comprehensive Income	2.68	86.36	(43.31)	
6.	Paid up Equity Share Capital	2.83	2.83	2.83	
7.	Reserves (Excluding Revaluation Reserve)	4,160.94	4,354.37	4,209.91	
8.	Securities Premium Account	1,715.28	1,715.28	1,715.28	
9.	Net Worth	4,163.77	4,357.20	4,212.74	
10.	Outstanding Debt	3,992.62	5,927.97	6,050.92	
11.	Outstanding Redeemable Preference Shares	None	None	None	
12.	Debt Equity Ratio	0.96	1.36	1.44	
13.	Earnings Per Share				
	Basic EPS (in ₹) (Not annualised)	9.61	305.52	166.83	
	Diluted EPS (in ₹) (Not annualised)	9.61	305.52	166.83	
14.	Capital Redemption Reserve	NA	NA	NA	
15.	Debt Redemption Reserve	NA	NA	NA	
16.	Debt Service Coverage Ratio	NA	NA	NA	
17.	Interest Service Coverage Ratio	NA	NA	NA	

Note: 1. The above unaudited financial results for the quarter and nine months ended December 31, 2024, have been reviewed by the Audit Committee and its recommendation, have been approved by the Board of Directors of the Company at its meeting held on January 21, 2025. The said results have been subjected to limited review by the Statutory Auditors of the Company, who have issued an unmodified report thereon.  
 2. The above financial results have been prepared in accordance with the recognition and measurement principles laid down in the Ind AS notified under Section 133 of the Companies Act, 2013 read with relevant rules issued thereunder and other accounting principles generally accepted in India and as per the format prescribed under Regulation 52 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, as amended and read with the operational circular for listing obligation and disclosure requirement dated July 29, 2022.  
 3. The above is an extract of the detailed format of unaudited financial results filed with BSE Limited (BSE) and National Stock Exchange of India Limited (NSE) (collectively referred as Stock Exchanges) under Regulation 52 of the SEBI Listing Regulations. The full format of said unaudited financial results are available on the websites of BSE at www.bseindia.com and NSE at www.nseindia.com and on the website of the Company at www.jmfinancialcreditsolutions.com.  
 4. The other details required under Regulation 52(4) of the SEBI LODR have been submitted to the Stock Exchanges and can be accessed at www.bseindia.com and www.nseindia.com.

For and on behalf of the Board of Directors  
 Sd/-  
**Harisharan Ramamurthy Aiyar**  
 Non-Executive Vice Chairman  
 (DIN: 01374306)  
 Place: Mumbai  
 Date: January 21, 2025

**GRIHUM HOUSING FINANCE LIMITED**  
 (FORMERLY POONAWALLA HOUSING FINANCE LIMITED)  
 CIN: U65927MH2004PLC020875  
 Registered Office: 6th Floor, B Building, Gangra Truena, Lohegaon, Pune - 411014, Maharashtra  
 Website: www.grihumhousing.com, E-mail: grihumsecretarial@grihumhousing.com  
 Tel: Pune: +91 020 67808991  
**Statement of Unaudited Financial Results for the Quarter ended 31 December, 2024**

(Regulation 52(B), read with Regulation 52(4) of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015)

Sl. No.	Particulars	Quarter Ended		
		31 December 2024 (Unaudited)	31 December 2023 (Unaudited)	31 March 2024 (Audited)
		₹ (in crores)		
1.	Total Income from Operations	316.57	270.41	1,565.65
2.	Net Profit/(Loss) for the period (before Tax and Exceptional Items)	68.89	48.79	183.25
3.	Net Profit/(Loss) for the period before tax (after Exceptional Items)	68.89	48.79	183.25
4.	Net Profit/(Loss) for the period after tax (after Exceptional Items)	51.78	36.82	139.96
5.	Total Comprehensive Income for the period (comprising Profit/(Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax))	51.59	36.59	139.37
6.	Paid-up equity share capital (Face value of ₹ 10/- each)	326.77	289.92	324.83
7.	Reserves (excluding Revaluation Reserve)	742.96	551.67	593.62
8.	Securities Premium Account	1,309.72	1,001.50	1,309.02
9.	Net Worth	2,540.07	1,943.09	2,369.86
10.	Paid up Debt Capital/Outstanding Debt	5,939.65	5,986.10	5,764.65
11.	Outstanding Redeemable Preference Shares	Not Applicable	Not Applicable	Not Applicable
12.	Debt Equity Ratio	2.34	3.25	2.41
13.	Earnings Per Share (of ₹10/- each) (for continuing and discontinued operations)*			
	a. Basic (in ₹)	1.59	1.34	5.03
	b. Diluted (in ₹)	1.06	1.33	3.15
14.	Capital Redemption Reserve	Not Applicable	Not Applicable	Not Applicable
15.	Debt Redemption Reserve	Not Applicable	Not Applicable	Not Applicable
16.	Debt Service Coverage Ratio	Not Applicable	Not Applicable	Not Applicable
17.	Interest Service Coverage Ratio	Not Applicable	Not Applicable	Not Applicable

\* Not Annualised for the quarters

Note: 1. The Unaudited financial results of the Company have been prepared in accordance with Indian Accounting Standards ("Ind AS") notified under Section 133 of the Companies Act 2013 ("the Act") read with the Companies (Indian Accounting Standards) Rules, 2015 as amended from time to time.  
 2. The above is an extract of the detailed format of quarterly financial results filed with the Stock Exchange (BSE) under Regulation 52 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 ("SEBI Listing Regulations"). The full format of the quarterly financial results is available on the website of the BSE (www.bseindia.com) and on the Company's website (www.grihumhousing.com).  
 3. For the other line items referred in the Regulation 52(4) of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, the pertinent disclosures have been made to the BSE and can be accessed on the website of BSE (www.bseindia.com) and on the Company's website (www.grihumhousing.com).  
 4. During the quarter ended 31 December 2024, CRISIL Ratings Limited upgraded the Company's long-term credit rating to 'CRISIL AA/Stable' from 'CRISIL AA-/Stable' and reaffirmed the short-term rating at 'CRISIL A1+'.  
 5. The Company has shifted its registered office to 6th Floor, B Building, Gangra Truena, Lohegaon, Pune - 411014, Maharashtra with effect from 18 December 2024, within the local limits of the city.  
 6. Figures for the previous year/period have been regrouped and / or reclassified wherever considered necessary.

By order of the Board  
**For Grihum Housing Finance Limited**  
 (Formerly Poonawalla Housing Finance Limited)  
**Manish Jalawal**  
 Managing Director & Chief Executive Officer  
 DIN: 07859441  
 Place: Pune  
 Date: 22 January, 2025

**ELECON ENGINEERING COMPANY LIMITED**  
 CIN: L29100GJ1960PLC001082  
 Regd. Office : Anand-Sojitra Road, Vallabh Vidyanagar - 388 120, Gujarat.  
 Ph: (02692) 238701 / 238702. Email: investor.relations@elecon.com Website: www.elecon.com  
**EXTRACT OF STATEMENT OF UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER AND NINE MONTHS ENDED ON 31<sup>ST</sup> DECEMBER, 2024**

Sr. No.	Particulars	Standalone				Consolidated					
		Quarter Ended		Nine months Ended		Quarter Ended		Nine months Ended			
		31-12-2024	31-12-2023	31-12-2024	31-12-2023	31-03-2024	31-12-2024	31-12-2023	31-03-2024		
		Unaudited				Unaudited					
		Audited				Audited					
1.	Total Income from Operations	44,632	38,330	115,838	111,434	159,967	52,889	47,356	142,939	137,280	193,742
2.	Net Profit / (Loss) for the period (before tax, Exceptional and/or Extraordinary items)	12,385	10,231	28,704	28,969	40,613	14,024	11,749	34,493	32,914	46,538
3.	Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items)	12,385	10,231	28,704	28,969	40,613	14,024	11,749	34,493	32,914	46,538
4.	Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items)	9,198	7,631	21,455	21,622	30,316	10,754	9,040	26,862	25,193	35,558
5.	Total Comprehensive Income for the period [Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	9,170	7,572	21,263	21,446	30,181	9,925	9,926	27,207	25,735	35,858
6.	Equity Share Capital - Paid-up Equity Share Capital (Face Value of the Equity Share ₹ 1/-)	2,244	2,244	2,244	2,244	2,244	2,244	2,244	2,244	2,244	2,244
7.	Reserves (excluding Revaluation Reserves)	-	-	-	-	132,507	-	-	-	-	158,159
8.	Earnings per share (of ₹ 1/- each) (for continuing and discontinuing operations)										
	(a) Basic	4.10	3.40	9.56	9.64	13.51	4.79	4.03	11.97	11.23	15.85
	(b) Diluted	4.10	3.40	9.56	9.64	13.51	4.79	4.03	11.97	11.23	15.85

Note: 1. The above is an extract of the detailed format of quarter and nine months financial results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the quarter and nine months financial results are available on the websites of the BSE Ltd. (www.bseindia.com), the National Stock Exchange of India Ltd. (www.nseindia.com) and on Company's website (www.elecon.com). The same can be accessed by scanning the QR Code provided above.  
 2. The above unaudited standalone and consolidated financial results for the quarter and nine months ended on 31<sup>st</sup> December, 2024 were reviewed and recommended by the Audit Committee and approved by the Board of Directors at their respective meetings held on 22<sup>nd</sup> January, 2025. The statutory auditors have expressed an unmodified conclusion on these standalone and consolidated financial results. The review reports have been filed with the stock exchanges and are available on the Company's website.  
 3. As per Ind AS 108 - Operating Segments, the Company has reported segment information under two segments i.e. 1) Transmission Equipment and 2) Material Handling Equipment  
 4. The Board of Directors of the Company declared an interim dividend of ₹ 0.50/- per equity share of ₹ 1/- each on 18<sup>th</sup> October, 2024 which was paid on 22<sup>nd</sup> November, 2024.  
 5. The Company has sub-divided its 11,21,99,965 equity shares having face value of ₹ 1/- each into 22,43,99,930 equity shares having face value of ₹ 1/- (One) per share effective from 19<sup>th</sup> July, 2024 ("Record Date"). Accordingly, earnings per share of comparative periods presented is calculated based on number of shares outstanding in respective periods, as increased due to sub-division of its equity shares.  
 6. Previous period figures have been regrouped / reclassified wherever necessary.

Place : Vallabh Vidyanagar  
 Date : 22<sup>nd</sup> January, 2025

For and on behalf of Board of Directors  
**Prayasin B. Patel, Chairman & Managing Director**  
 DIN : 00037394

